



ISBN 978-93

ઇસ્તિન્જા કા તરીકા

ISTINJA KA TARIQA (GUJARATI)

- ★ આબે ઝમઝમ સે ઇસ્તિન્જા કરના કેસા ? 5
- ★ રફ્એ હાજત કે લિયે બેઠને કા તરીકા 11
- ★ ઇસ્તિન્જા કે ઢેલોં કે અહકામ 8
- ★ ટોઇલેટ પેપર સે પૈદા હોને વાલે અમરાઝ 13
- ★ ભૈતુલ ખલા જાને કી 47 નિયતોં 16

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, ડાનિયે દા'વતે ઇસ્લામી, હારત અલ્લામા મૌલાના અબૂ ઝિલાલ

મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ૨-ઝવી داست برکاتیم العالمیه

مکتبۃ الدینہ
(مکتبۃ اسلامی)

SC1286

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઠવે ઠી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે
દા'વતે ઇસ્લામી, હઝરતે અલ્લામા મૌલાના અબૂ બિલાલ
મુહમ્મદ ઇલ્યાસ અવાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ

દીની કિતાબ યા ઇસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી
હુઈ દુઆ પઢ લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ
યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِمَمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحِمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા: ઐ અલ્લાહ عَزَّوَجَلَّ હમ પર ઇલ્મો હિકમત કે દરવાઝે ખોલ દે ઔર
હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઔર બુઝુર્ગી વાલે.

(المستطرف ج ١ ص ٤٠١ دار الفكر بيروت)

નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે
મદીના
વબકીઅ
વ મગ્કિરત



13, શવ્વાલુલ મુકર્રમ સિ. 1428 હિ.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

“ઈસ્તિન્જા કા તરીકા”

યેહ રિસાલા (ઈસ્તિન્જા કા તરીકા)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ને ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએ તો મજલિસે તરાજિમ કો (બઝરીઅએ મક્તૂબ, ઈ-મેઈલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જદ કે સામને, તીન દરવાઝા-1,

અહમદ આબાદ, ગુજરાત, ઈન્ડિયા

MO. : 9374031409

E-mail : translaionmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 مَا بَعُدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ઈસ્તિલાહ ઠા વરીઠા (ઠ-ઠફી)

શૈતાન લાખ રોકે યેહ રિસાલા (18 સફહાત) મુકમ્મલ પઠ લીજિયે,

إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ ઈસ કે ફવાઈદ ખુદ હી દેખ લેંગે.

દુરદ શરીફ કી ફઝીલત

સરકારે નામદાર, મદીને કે તાજદાર, હબીબે પરવદ ગાર,

શફીએ રોઝે શુમાર, જનાબે અહમદે મુખ્તાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ઈશાદિ નૂરબાર હૈ : “તુમ અપની મજલિસોં કો મુઝ પર દુરદે પાક

પઠ કર આરાસ્તા કરો ક્યૂંકે તુમહારા મુઝ પર દુરદે પાક પઠના બરોઝે

ક્રિયામત તુમહારે લિયે નૂર હોગા.”

(الْجَامِعُ الصَّغِيرُ لِلشُّيُوطِيِّ ص ٢٨٠ حَدِيثُ ٤٥٨٠)

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

અઝાબ મેં તખ્ફીફ હો ગઘ

હઝરતે સય્યિદુના ઈબને અબ્બાસ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا સે મરવી હૈ કે સરકારે

દો² આલમ, નૂરે મુજસ્સમ, શાહે બની આદમ, રસૂલે મુહ્તશમ

دَوِّ2 کَثْرًا كَيْ يَكُونَ فِي مَنَاحِيْرِهِمْ دَوِّ2 كَثْرًا كَيْ يَكُونَ فِي مَنَاحِيْرِهِمْ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

इरमाबे मुस्ताफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिसके पास मेरा जिड हुवा और उस ने मुझ पर दुइडे पाक न पढा तहकीक वोह अदभुत हो गया. (ईप्ने सुन्नी)

इरमाया : येह दोनों² कअ्र वाले अजाब दिये जा रहे हैं और किसी बडी चीज में (जिस से बयना दुश्वार हो) अजाब नहीं दिये जा रहे बल्के अेक तो पेशाब के छींटों से नहीं बयता था. और दूसरा युगुल भोरी किया करता था इर आप صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने भजूर की ताजा टहनी मंगवाई और उसे आधों आध थीरा और हर अेक की कअ्र पर अेक अेक हिससा गाड दिया और इरमाया : जब तक येह पुशक न हों तब तक इन दोनों² के अजाब में तप्कीइ होगी.

(سُنَنِ نَسَائِي ص ۱۳ حدیث ۳۱، صحیح بخاری ج ۱ ص ۹۵ حدیث ۲۱۶)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ईस्तिन्ना का तरीका

✽ ईस्तिन्ना खाने में जिन्नात और शयातीन रहते हैं अगर खाने से पहले बिस्मिल्लाह पढ ली जाये तो उस की ब-र-कत से वोह सित्र दैभ नहीं सकते. हदीसे पाक में है : जिन्न की आंभों और लोगों के सित्र के दरमियान पर्दा येह है के जब पाखाने को जाये तो बिस्मिल्लाह कड ले.¹ या'नी जैसे दीवार और पर्दे लोगों की निगाह के लिये आड बनते हैं जैसे ही येह अद्लाह (عَزَّوَجَلَّ) का ठिक जिन्नात की निगाहों से आड बनेगा के जिन्नात उस को दैभ न सकेंगे.² ✽ ईस्तिन्ना खाने में दाभिल होने से पहले बिस्मिल्लाह पढ लीजिये बल्के बेहतर है के

دينه

ફરમાને મુસ્લફા : سُبْحَانَكَ اللَّهُمَّ رَبِّيَ الْأَعْلَى : જિસ ને મુઝ પર દસ મરતબા સુબ્હ આર દસ મરતબા શામ દુરુદે પાઠવા ઉસે કિયામત કે દિન મેરી શફાયત મિલેગી. (મજમઉજ્જવાઈદ)

યેહ દુઆ પઠ લીજીયે : (અવ્વલ વ આખિર દુરુદ શરીફ)

بِسْمِ اللَّهِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ يَا نَبِيَّ اللَّهِ

مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ يَا اللَّهُ !

(کتاب الدعاء للطبرانی حدیث ۳۰۷ ص ۱۳۲) વ માદા) સે તેરી પનાહ માંગતા હું.

✽ ફિર પહલે ઉલ્ટા કદમ ઈસ્તિન્જા ખાને મેં રખ કર દાખિલ

હોં ✽ સર ઢાંપ કર ઈસ્તિન્જા કરેં ✽ નંગે સર ઈસ્તિન્જાખાને મેં

દાખિલ હોના મમ્નૂઅ હૈ ✽ જબ પેશાબ કરને યા કઝાએ હાજત કે

લિયે બૈઠે તો મુંહ ઓર પીઠ દોનોં² મેં સે કોઈ ભી કિબ્લા કી તરફ ન

હો અગર ભૂલ કર કિબ્લા કી તરફ મુંહ યા પુશત કર કે બૈઠ ગએ તો

યાદ આતે હી ફૌરન કિબ્લા કી તરફ સે ઈસ તરહ રુખ બદલ દે કે કમ

અઝ કમ 45 ડિગ્રી સે બાહર હો જાએ ઈસ મેં ઉમ્મીદ હૈ કે ફૌરન ઉસ

કે લિયે મગિફરત વ બખ્શિશ ફરમા દી જાએ ✽ બચ્ચોં કો ભી કિબ્લા

કી તરફ મુંહ યા પીઠ કરા કે પેશાબ યા પાખાના ન કરાએં, અગર

કિસી ને એસા કિયા તો વોહ ગુનહગાર હોગા ✽ જબ તક કઝાએ

હાજત કે લિયે બૈઠને કે કરીબ ન હો કપડા બદન સે ન હટાએ ઓર ન

હી ઝરૂરત સે ઝિયાદા બદન ખોલે ✽ ફિર દોનોં² પાઉં ઝરા

કુશાદા(યા'ની ખુલે) કર કે બાએં (યા'ની ઉલ્ટે) પાઉં પર ઝોર દે કર

બૈઠે કે ઈસ તરહ બડી આંત કા મુંહ ખુલતા હૈ ઓર ઈજાબત આસાની

સે હોતી હૈ ✽ કિસી દીની મસ્અલે પર ગૌર ન કરે કે મહરૂમી કા

બાઈસ હૈ ✽ ઉસ વક્ત છીંક ✽ સલામ યા ✽ અઝાન કા જવાબ

ઝબાન સે ન દે ✽ અગર ખુદ છીંકે તો ઝબાન સે اَلْحَمْدُ لِلَّهِ ન કહે,

इरमाने मुस्ताहा : قبل التناول عليه واليوسنة : जिसके पास मेरा भिड़ हुआ और उसने मुझ पर दुश्मती शरीफ़ न
पढा उसने जड़ा की. (अब्दुर्रुआड)

दिल में कड़वे ✨ बातचीत न करे ✨ अपनी शर्मगाह की तरफ़ न
देखे ✨ उस नज़ासत को न देखे जो बदन से निकली है ✨ प्वाह म
प्वाह देर तक ईस्तिन्जापाने में न बैठे के बवासीर होने का अन्देश
है ✨ पेशाब में न थूके, न नाक साफ़ करे, न बिला ज़रूरत पन्कारे, न
बार बार धर धर देखे, न बेकार बदन धूमे, न आस्मान की तरफ़
निगाह करे, बल्के शर्म के साथ सर झुकाये रहे ✨ कज़ाये हाज़त से
झारिग होने के बाद पहले पेशाब का मकाम धोये फिर पापाने का
मकाम ✨ पानी से ईस्तिन्जा करने का मुस्ताहब तरीका येह है के ज़रा
कुशादा (या'नी फुदा) हो कर बैठे और सीधे हाथ से आहिस्ता आहिस्ता
पानी डाले और उल्टे हाथ की उँगलियों के पेट से नज़ासत के मकाम को
धोये. उँगलियों का सिरा न लगे और पहले बीच की उँगली उंगी रभे
फिर उस के बराबर वाली इस के बाद छोटी उँगली को उंगी रभे,
लोटा उंगी रभे के छिटें न पड़ें, सीधे हाथ से ईस्तिन्जा करना मक़रूह है
और धोने में मुबा-लगा करे या'नी सांस का दबाव नीचे की जानिब
डाले यहां तक के अच्छी तरह नज़ासत का मकाम धुल जाये या'नी
इस तरह के चिकनाई का असर बाकी न रहे अगर रोज़ादार हो तो
फिर मुबा-लगा न करे ✨ तहारत हासिल होने के बाद हाथ भी पाक हो
गये लेकिन बाद में साबुन वगैरा से भी धो ले. ¹ ✨ जब ईस्तिन्जा पाने
से निकले तो पहले सीधा कदम बाहर निकाले और बाहर निकलने के

دينه

1 : बहार शरीअत, जि. 1 स. 408 , ١١٥ص١ رُكُؤُالتَّحْتَارِجِ वगैरा

करमाने मुस्तक़ा : صَلَّيْتُ الرَّغْلَيْنِ عَلَيْهِمَا وَبِهِمَا سَلَّمَ : जो मुँह पर रोखें जुमुआ दुश्द शरीफ़ पढेगा मैं डियामत के दिन उस की शरअत कड़ेगा. (क़ब्रुल उम्मा)

बा'द (अव्वल आभिर दुश्द शरीफ़ के साथ) येह दुआ पढे :

أَلْحَمْدُ لِلَّهِ الَّذِي آذَنَهُ عَنِّي يَا'नी अल्लाह तआला का शुक्र है जिस

الْأَذَى وَعَا فَانِي ने मुज से तकलीफ़ देह बीज को दूर किया

(سُنَنُ ابْنِ مَاجَةَ ج ١ ص ١٩٣ حدیث ٣٠١) और मुझे आफ़ियत (राहत) बफ़शी.

बेहतर येह है के साथ में येह दुआ भी मिला ले इस तरह दो

हदीसों पर अमल हो जाओगा : عَزَّوَجَلَّ تَرَجَمًا : مَنِ اذَّلَاذَ

سَعَةٍ تَرَجَمًا : مَنِ اذَّلَاذَ (سُنَنُ تِرْمِذِي ج ١ ص ٨٧ حدیث ٧)

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

आबे झम झम से ईस्तिन्जा करना कैसा ?

✽ झमझम शरीफ़ से ईस्तिन्जा करना मक़रूह है और ढेला न लिया

हो तो ना जाईज. (बहारे शरीअत, जि. 1, स. 413) ✽ वुजू के बक़िया

पानी से तहारत करना भिलाई औला है. (अैज़न) ✽ तहारत के बये

हुअे पानी से वुजू कर सकते हैं, बा'ज लोग जो इस को ईंक देते हैं येह

न याहिये ईस्राफ़ में दाख़िल है. (अैज़न)

ईस्तिन्जापाने का रुख़ दुरुस्त रभिये

अगर भुदा न प्वास्ता आप के घर के ईस्तिन्जा पाने का रुख़

गलत है या'नी बैठते वक्त क़िब्ला की तरफ़ मुंह या पीठ छोती है तो

इस को दुरुस्त करने की फ़ौरन तरकीब कीजिये. मगर येह जेह्न में

रहे के मा'मूली सा तिरछा करना काफ़ी नहीं. W.C. इस तरह हो के

ફરમાને મુસ્તફા : صَلَّ اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : મુજ પર દુરુદ પાઠ કરી કસરત કરો બેશક યેહ તુમ્હારે લિયે તહારત હૈ. (અબુ યા'લા)

બેઠતે વક્ત મુંહ યા પીઠ કિબ્લે સે 45 ડિગ્રી કે બાહર રહે. આસાની ઈસી મેં હૈ કે કિબ્લા સે 90 ડિગ્રી પર રુખ રખિયે. યા'ની નમાઝ કે બા'દ દોનો² બાર સલામ ફૈરને મેં જિસ તરફ મુંહ કરતે હેં ઈન દોનો² સમ્તોં મેં સે કિસી એક જાનિબ W.C. કા રુખ રખિયે.

ઈસ્તિન્જા કે બા'દ કદમ ધો લીજિયે

પાની સે ઈસ્તિન્જા કરતે વક્ત ઉમૂમન પાઉં કે ટપ્નોં કી તરફ છીંટે આ જાતે હેં લિહાઝા એહતિયાત ઈસી મેં હૈ કે બા'દે ફરાગત કદમોં કે વોહ હિસ્સે ધો કર પાક કર લિયે જાએ મગર યેહ ખયાલ રહે કે ધોને કે દૌરાન અપને કપડોં યા દીગર ચીઝોં પર છીંટે ન પડે.

બિલ મેં પેશાબ કરના

રહમત વાલે આકા, દો² જહાં કે દાતા, શાફેએ રોઝે જઝા, મક્કી મ-દની મુસ્તફા, મહબૂબે કિબ્રિયા صَلَّ اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને શફકત નિશાન હૈ : તુમ મેં સે કોઈ શખ્સ સૂરાખ મેં પેશાબ ન કરે. (سُنَنِ نَسَائِي ص ١٤٦ حَدِيث ٣٤)

જિન્ન ને શહીદ કર દિયા

મુફસ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફતી અહમદ યાર ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَان ફરમાતે હેં : જુહૂર સે મુરાદ યા ઝમીન કા સૂરાખ હૈ યા દીવાર કી ફટન (યા'ની દરાડ), ચૂંકે અક્સર સૂરાખોં મેં ઝહરીલે જાનવર (યા) ચ્યૂંટિયાં વગૈરા કમઝોર જાનવર યા જિન્નાત રહતે હેં, ચ્યૂંટિયાં પેશાબ યા પાની સે તકલીફ પાએંગી યા સાંપ વ જિન્ન

इरमाओ मुस्ताडा : صلى الله عليه وسلم तुम जहां भी हो मुझ पर दुश्मद पढो के तुम्हारा दुश्मद मुझ तक पहुंचता है. (त-भरबी)

निकल कर हमें तकलीफ़ देंगे, इस लिये वहां पेशाब करना मन्अ इरमाया गया. युनान्थे (हजरते सय्यिदुना) सा'द एब्ने उबादा अन्सारी (رضى الله تعالى عنه) की वफ़ात इसी से हुँ के आप (رضى الله تعالى عنه) ने अेक सूराभ में पेशाब किया, जिन्न ने निकल कर आप को शहीद कर दिया. लोगों ने उस सूराभ से येह आवाज सुनी :

نَحْنُ قَتَلْنَا سَيِّدَ الْخَرْجِ سَعْدَ بْنَ عُبَادَةَ وَرَمَيْنَاهُ بِسَهْمٍ فَلَمْ نُخْطِ فُؤَادَهُ
तरजमा : या'नी हम ने कबीला भजरज के सरदार सा'द बिन उबादा (رضى الله تعالى عنه) को शहीद कर दिया और हम ने (अैसा) तीर मारा जो उन के दिल से आरपार हो गया.
(मुरा'ज १ व २६७, मुरफ़ा'ज २ व ७२, وأشعة اللّمعات ج १ ص २२०)

अद्लाउद् एरु'ज की उन पर रहमत हो और उन के सदके हमारी मग्दिरत हो.
अमिन بجاه النبي الامين صلى الله تعالى عليه وآله وسلم

हमाम में पेशाब करना

सरकारे मदीनअे मुनव्वरह, सरदारे मक्कअे मुकर्रमा ने इरमाया : कोई गुस्ल खाने में पेशाब न करे, इर इस में नहाअे या वुजू करे के अकसर वस्वसे इस से होते हैं. (अबुदौद ज १ व ६६ हदीथ १७) मुइस्सिरे शहीर हकीमुल उम्मत हजरते मुइती अहमद यार खान عليه وصحة الصحابة इस हदीसे पाक के तहत इरमाते हैं : अगर गुस्ल खाने की जमीन पुप्ता हो, और इस में पानी खारिज होने की नाली भी हो तो वहां पेशाब करने में हरज नहीं अगर्थे बेहतर है के न करे, लेकिन अगर जमीन कश्ची हो, और पानी निकलने का रास्ता भी न हो तो पेशाब करना सप्त बुरा है के जमीन नजिस हो जाअेगी, और गुस्ल या वुजू में गन्दा पानी जिस्म

इरमाने मुस्तहब عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : जिस ने मुझ पर दस मर्तबा दूबड़े पाक पढा अल्लाह عَزَّ وَجَلَّ उस पर सो रहमतें नाज़िल इरमाता है (त-भसानी)

पर पडेगा. यहाँ दूसरी सूरत ही मुराद है इस लिये ताकीदी मुमा-न-अत इरमाई गई, या'नी इस से वस्सवों और वलम की भीमारी पैदा होती है जैसा के तजरिबा है या गन्दी छीटें पडने का वस्वसा रहेगा. (भिर्मात, जि. 1, स. 266)

ईस्तिन्जा के ढेलों के अहकाम

❁ आगे पीछे से जब नजासत निकले तो ढेलों से ईस्तिन्जा करना सुन्नत है, और अगर सिर्फ़ पानी ही से तहारत कर ली तो भी जाईज है, मगर मुस्तहब येह है के ढेले लेने के बा'द पानी से तहारत करे. ❁ आगे और पीछे से पेशाब, पाप्पाने के सिवा कोई और नजासत, म-सलन भून, पीप वगैरा निकले या इस जगह पारिज से नजासत लग जाये तो भी ढेले से साफ़ कर लेने से तहारत हो जायेगी, जब के उस मौजअ (या'नी जगह) से बाहर न हो मगर धो डालना मुस्तहब है ❁ ढेलों की कोई ता'दादे मुअय्यन (या'नी मुकर्ररा ता'दाद) सुन्नत नहीं, बल्के जितने से सफ़ाई हो जाये, तो अगर अक से सफ़ाई हो गई सुन्नत अदा हो गई और अगर तीन³ ढेले लिये और सफ़ाई न हुई सुन्नत अदा न हुई, अलबत्ता मुस्तहब येह है के ताक (म-सलन अक, तीन, पांच) हों और कम से कम तीन³ हों तो अगर अक या दो² से सफ़ाई हो गई तो तीन³ की गिनती पूरी करे, और अगर चार से सफ़ाई हो तो अक और ले के ताक हो जाये ❁ ढेलों से तहारत उस वक्त होगी के नजासत से मभरज (या'नी पारिज होने की जगह) के आसपास की जगह अक द्दिरहम¹ से ज़ियादा आलूदा न हो और अगर द्दिरहम से ज़ियादा सन जाये तो धोना फ़र्ज़ है, بِهِ

1 : द्दिरहम की मिक्दार मक-त-बतुल मदीना की मल्बूआ बहारे शरीअत जिहद 1 सफ़हा 389 पर मुला-हज़ा इरमाईये.

इसगाने मुस्तहब : जिसके पास मेरा भिड़ हो और वोह मुझ पर दुश्द शरीक न पड़े तो वोह लोगों में से कबूतस तरीक शप्स है. (तस्बीह व तस्हीब)

मगर ढेले लेना अब भी सुन्नत रहेगा. ❀ कंकर, पथ्थर, इंटा हुवा कपडा येह सब ढेले के हुकूम में हैं, एन से भी साफ़ कर लेना बिला कराहत जाईज है (बेहतर येह है के इंटा कपडा या दरजी की बे कीमत कतरन सूती (COTTAN) हो ताके जल्द ज़ूब कर ले) ❀ हडी और पाने और गोबर और पक्की ईंट और ठेकरी और शीशा और कोअेले और ज़ानवर के यारे से और ऐसी चीज से जिस की कुछ कीमत हो, अगर्ये अेक आध पैसा सही, एन चीजों से ईस्तिन्जा करना मक़रूह है ❀ कागज़ से ईस्तिन्जा मन्अ है, अगर्ये उस पर कुछ लिखा न हो, या अबू जहूल जैसे काफ़िर का नाम लिखा हो ❀ दाहिने (या'नी सीधे) हाथ से ईस्तिन्जा करना मक़रूह है, अगर किसी का बायां हाथ बेकार हो गया, तो उसे दाहिने (सीधे) हाथ से जाईज है ❀ जिस ढेले से अेक बार ईस्तिन्जा कर लिया उसे दोबारा काम में लाना मक़रूह है, मगर दूसरी करवट उस की साफ़ हो तो उस से कर सकते हैं ❀ मर्द के लिये पीछे के मक़ाम के लिये ढेलों के ईस्ति'माल का तरीका येह है के गरमी के मौसिम में पहला ढेला आगे से पीछे को ले जाअें, दूसरा पीछे से आगे को और तीसरा आगे से पीछे को, सर्दियों में पहला ढेला पीछे से आगे, दूसरा आगे से पीछे को और तीसरा पीछे से आगे को ले जाअें. ❀ पाक ढेले दाहिनी (या'नी सीधी) जानिब रबना और बा'द काम में लाने के बाईं (उल्टे हाथ की) तरफ़ डाल देना, इस तरह पर के जिस रुब में नज़ासत लगी हो नीचे हो, मुस्तहब है. (बहारे शरीअत, जि. 1, स. 410 ता 412, १-६१ सल्लल्लु अलैहि व अलैहि सलाम) ❀ टॉयलेट पेपर के ईस्ति'माल की उ-लमा ने

ફરમાને મુસ્તાફા ﷺ : ઉસ શખ્સ કી તાક પાક આવૂદ હો જિસ કે પાસ મેરા ઝિંક હો
 ઓર વોહ મુઝ પર દુસ્દે પાક ન પહે. (હાકિમ)

ઈજાઝત દી હૈ ક્યૂંકે યેહ ઈસી મક્સદ કે લિયે બનાયા ગયા હૈ લિખને મેં
 કામ નહીં આતા. અલબત્તા બેહતર મિટ્ટી કા ઢેલા હૈ.

મિટ્ટી કા ઢેલા ઓર સાઈન્સી તહકીક

એક તહકીક કે મુતાબિક મિટ્ટી મેં નૌશાદર (AMMONIUM CHLORIDE) નીઝ બદબૂ દૂર કરને વાલે બેહતરીન અજઝા મૌજૂદ હેં. પેશાબ ઓર ફુઝલા જરાસીમ સે લબરેઝ હોતા હૈ, ઉસ કા જિસ્મે ઈન્સાની પર લગના નુક્સાન દેહ હૈ. ઉસ કે અજઝા બદન પર ચિપટે રહ જાને કી સૂરત મેં તરહ તરહ કી બીમારિયાં પૈદા હોને કા અન્દેશા હૈ. “ડૉક્ટર હિલોક” લિખતા હૈ : ઈસ્તિન્જા કે મિટ્ટી કે ઢેલે ને સાઈન્સી દુન્યા કો વર્તએ હૈરત મેં ડાલ રખા હૈ. મિટ્ટી કે તમામ અજઝા જરાસીમ કે કાતિલ હોતે હેં લિહાઝા મિટ્ટી કે ઢેલે કે ઈસ્તિ’માલ સે પર્દે કી જગહ પર મૌજૂદ જરાસીમ કા ખાતિમા હો જાતા હૈ બલ્કે ઈસ કા ઈસ્તિ’માલ “પર્દે કી જગહ કે કેન્સર” (CANCER OF PENIS) સે બચાતા હૈ.

બુદ્દે કાફિર ડૉક્ટર કા ઈન્કિશાફ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! સુન્નત કે મુતાબિક કઝાએ હાજત કરને મેં આખિરત કી સઆદત ઓર દુન્યા મેં બીમારિયોં સે હિફાઝત હૈ. કુફ્ફાર ભી ઈસ્લામી અત્વાર કા ખ્વાહી નખ્વાહી ઈકરાર કર હી લેતે હેં. ઈસ કી ઝલક ઈસ હિકાયત મેં મુલા-હઝા ફરમાઈયે : યુનાન્થે ફિઝયૉલોજી કે એક સીનિયર પ્રોફેસર કા બયાન હૈ : મૈં ઉન દિનોં મરાકિશ મેં થા, મુઝે બુખાર આ ગયા, દવા કે લિયે એક ગૈર મુસ્લિમ બુદ્દે ઘાગ ડૉક્ટર કે પાસ પહોંચા, ઉસ ને પૂછા : ક્યા મુસલ્માન હો ? મૈં ને કહા : હાં મુસલ્માન હૂં ઓર પાકિસ્તાની હૂં. યેહ સુન કર કહને

ફરમાને મુશ્કાલ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस न मुख पर रोज़े जुमुआ दो सो बार दूइडे पाक पढा उस के दो सो साल के गुनाह मुआइ होंगे. (कबूल उम्मा)

લગા : અગર તુમ્હારે પાકિસ્તાન મેં એક તરીકા જો ખુદ તુમ્હારે નબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા બતાયા હુવા હૈ ઝિન્દા હો જાએ તો પાકિસ્તાની બહોત સારે અમરાઝ સે બચ જાએં ! મેં ને હૈરત સે પૂછા : વોહ કૌન સા તરીકા હૈ ? બોલા : અગર કઝાએ હાજત કે લિયે ઈસ્લામી તરીકે પર બૈઠા જાએ તો એપન્ડેસાઈટિસ (APPENDISITIS), દાઈમી કબ્ઝ, બવાસીર ઓર ગુદોં કે અમરાઝ નહીં હાંગે !

રફૂએ હાજત કે લિયે બૈઠને કા તરીકા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! યકીનન આપ ભી જાનના ચાહંગે કે વોહ કરિશ્માતી તરીકા કૌન સા હૈ તો સુનિયે ! હઝરતે સચ્ચિદુના સુરાકા બિન માલિક رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ફરમાતે હેં : હમેં તાજદારે રિસાલત, સારાપા અ-ઝ-મતો શરાફત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને હુકમ દિયા કે હમ રફૂએ હાજત કે વક્ત બાએં (ઉલ્ટે) પાઉં પર વઝૂન દેં ઓર દાયાં પાઉં ખડા રખેં.

(مَجْمَعُ الرَّوَاةِ ج ١ ص ٤٨٨ حديث ١٠٢٠)

બાએં પાઉં પર વઝૂન ડાલને કી હિકમત

રફૂએ હાજત કે વક્ત ઉકડું બૈઠ કર દાયાં (સીધા) પાઉં ખડા યા'ની અપની અસ્લી હાલત પર (NORMAL) રખ કર બાએં યા'ની ઉલ્ટે પાઉં પર વઝૂન દેને સે બડી આંત જો કે ઉલ્ટી તરફ હોતી હૈ ઓર ઉસી મેં ફુઝલા હોતા હૈ ઉસ કા મુંહ અચ્છી તરહ ખુલ જાતા ઓર બ આસાની ફરાગત હો જાતી ઓર પેટ અચ્છી તરહ સાફ હો જાતા હૈ ઓર જબ પેટ સાફ હો જાએગા તો બહોત સારી બીમારિયોં સે તહફફુઝ હાસિલ રહેગા.

इरमाने मुस्वहा : من انزلنا من السماء ماء فاصبح ارضنا خضرة : मुझ पर दुइद शरीर पढे अल्लाह तुम पर रहमत भेजेगा.

(ईफले अदी)

कुरसी नुमां कमोड

अइसोस ! आजकल ईस्तिन्ना के लिये कमोड (COMMODE)

आम होता जा रहा है ईस पर कुरसी की तरह बैठने के सभब टांगें पूरी तरह नहीं खुलतीं, उकड़ूं बैठने की तरकीब न होने के सभब उल्टे पाँउं पर वज़न भी नहीं दिया जा सकता और यूं आंतों और मे'दे पर जोर नहीं पडता ईस लिये बराबर इरागत नहीं हो पाती कुछ न कुछ कुजला आंत में बाकी रह जाता है जिस से आंतों और मे'दे के मु-तअद्दिद अमराज पैदा होने का अन्देशा रहता है. कमोड के ईस्ति'माल से आ'साबी तनाव पैदा होता है, हाजत के बा'द पेशाब के कतरात गिरने के भी भतरात रहते हैं.

पर्दे की जगह का केन्सर

कुरसी नुमां कमोड में पानी से ईस्तिन्ना करना और अपने बदन और कपड़ों को पाक रखना अेक अम्रे दुश्वार है. जियादा तर ईस के लिये टॉइलेट पेपर्ज का ईस्ति'माल होता है. कुछ अर्सा कब्ल यूरोप में पर्दे के छिस्सों के मोडलिक अमराज बिल भुसूस पर्दे की जगह का केन्सर तेजी से फैलने की खबरें अज्बारात में शाअेअ हुई, तहकीकी बोर्ड बैठा और उस ने नतीजा येह बयान किया के ईन अमराज के दो² ही अरबाब सामने आअे हैं (1) टॉइलेट पेपर का ईस्ति'माल करना और (2) पानी का ईस्ति'माल न करना.

टॉइलेट पेपर से पैदा होने वाले अमराज

टॉइलेट पेपर बनाने में बा'ज अैसे केमीकल ईस्ति'माल होते

इस्तीन्ना मुस्तदा : मुग पर इस्तिन्ना से दुइटे पाड पढे भेसक तुम्हारा मुग पर दुइटे पाड पढना तुम्हारे गुनाहों के लिये मगइस्ति है. (जमेजे अगीर)

हैं जो जिल्द (यमडी) के लिये इन्तिहाई नुक्सान देल हैं. ईस के इस्ति'माल से जिल्दी अमराज पैदा होते हैं जैसा के अग्लीमा और यमडी का रंग तब्दील होना. "डॉक्टर केनन ड्यूस" का कहना है : टोईलेट पेपर का इस्ति'माल करने वाले इन अमराज के इस्तिकमाल की तय्यारी करें (1) पर्दे की जगह का केन्सर (2) लगन्टर (अक झोडा जो मकअद के आसपास होता या'नी बैठने की जगह पर और बडोत तकलीफ पछोयाता है) (3) जिल्द इन्फेक्शन (SKIN INFECTION) (4) इन्फेक्टी के अमराज (VIRAL DISEASES)

टोईलेट पेपर और गुर्दों के अमराज

अतिष्णा का कहना है के टोईलेट पेपर से सफाई बराबर नहीं होती लिहाजा जरासीम झैलते और ब-दने इन्सानों में जा कर तरह तरह की बीमारियों का सबब बनते हैं. फुसूसन औरतों की पेशाब गाह के जरीअे गुर्दों में दाबिल हो जाते हैं. जिस के सबब बसा अवकात गुर्दों से पीप आना शुर्अ हो जाता है. हां टोईलेट पेपर के इस्ति'माल के बा'द अगर पानी से इस्तिन्ना कर लिया जाअे तो ईस का नुक्सान न होने के बराबर रह जाता है.

सप्त ममीन पर कमाअे हाजत के नुक्सानात

कुरसी नुमा कमोड और W.C. का इस्ति'माल शरअन जाईज है. सहूलत के लिहाज से कमोड के मुकाबले में W.C. बेहतर है जब के इतना कुशादा (या'नी योणा) हो के ईस पर सुन्नत के मुताबिक बैठा जा सके. लेकिन आजकल छोटे W.C. लगाअे जाते हैं और इन में कुशादा हो कर नहीं बैठा जा सकता. हां अगर कदमये या'नी पाँ

કરમાને મુસ્લિમ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર એક દુરદ શરીફ પઢતા હે અલ્લાહ عزوجل ઉસ કે લિયે એક કીચત અજ્જ લિખતા હૈ ઓર કીચત ઉદુદ પઢાડ જિતના હૈ. (અબુદુરુઝાહ)

રખને કી જગહ ફર્શ કે સાથ હમવાર રખી જાએ તો હરબે ઝરૂરત કુશાદા બૈઠા જા સકતા હૈ. એક સુન્નત નર્મ ઝમીન પર રફ્એ હાજત કરના ભી હૈ. જૈસા કે હદીસે રસૂલ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મેં હૈ : જબ તુમ મેં સે કોઈ પેશાબ કરના ચાહે તો પેશાબ કે લિયે નર્મ જગહ ઢૂંઢે. (الْجَامِعُ الصَّغِيرُ ص ૩૭ حدیث ૦૧૦૭). ઈસ કે ફવાઈદ કો તસ્લીમ કરતે હુએ લયુવલ પોવલ (louval poul) કહતા હૈ : “ઈન્સાન કી બકા મિટ્ટી ઓર ફના ભી મિટ્ટી હૈ જબ સે લોગોં ને નર્મ મિટ્ટી કી ઝમીન પર કઝાએ હાજત કરને કે બજાએ સપ્ત ઝમીન (યા’ની W.C., કમોડ વગૈરા) કા ઈસ્તિ’માલ શુરૂઅ ક્રિયા હૈ ઉસ વક્ત સે મર્દોં મેં જિન્સી (મર્દાના) કમઝોરી ઓર પથરી કે અમરાઝ મેં ઈઝાફા હો ગયા હૈ ! સપ્ત ઝમીન પર હાજત કરને કે અસરાત મસાને કે ગુદૂદ (PROSTATE GLANDS) પર ભી પડતે હૈં, પેશાબ યા ફુઝલા જબ નર્મ ઝમીન પર ગિરતા હૈ તો ઉસ કે જરાસીમ ઓર તેઝાબિય્યત ફૌરન જઝબ હો જાતે હૈં જબ કે સપ્ત ઝમીન ચૂકે જઝબ નહીં કર પાતી ઈસ લિયે તેઝાબી ઓર જરાસીમી અસરાત બરાહે રાસ્ત જિસ્મ પર હમ્લા આવર હોતે ઓર તરહ તરહ કે અમરાઝ કે બાઈસ બનતે હૈં.

આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ **દૂર તશરીફ લે જાતે**

મદીને કે સુલ્તાન, રહમતે આ-લમિયાન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી શાને અ-ઝમત નિશાન પર કુરબાન કે જબ કઝાએ હાજત કો તશરીફ લે જાતે તો ઈતની દૂર જાતે કે કોઈ ન દેખે. (ابوداؤد ج ۱ ص ۳۰ حدیث ۲)

इस्माने मुश्तक्का صَلَّيْ اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ : जिस लो डिताब में मुख पर दूश्दे पाऊ लिप्पा तो जब तक मेरा नाम उस में रहेगा इस्तिग़्ज़ा के लिये इस्तिग़्ज़ार करते रहेंगे. (त-अरबी)

और अगर यटियल मैदान होता तो धतनी दूर तशरीफ़ ले जाते जहां किसी की निगाह न पड सकती. (मिआत, जि.1, स.262) यकीनन सरकारे मदीना صَلَّيْ اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ के हर फ़ै'ल में दीनो दुन्या की बे शुमार त्वाइयां पिन्हां होती हैं. पेशाब करने के आ'द अगर हर इर्द अक लोटा पानी बहा दिया करे तो اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ وَأَسْأَلُكَ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ और जरासीम की अइजाधश में कमी होगी, बडा पेशाब करने के आ'द भी जहां अक आध लोटा पानी काफ़ी हो वहां इलश टेन्क से पानी न बहाया जाअे क्यूंके वोह कर्छ लोटे पर मुश्तमिल होता है.

क़ाअे हाजत से क़बल यलने के इवाइद

आजकल बिल प्रूसूस शहरों में अन्द कमरे के अन्दर ही बैतुल खला (अटेय बाथ ATTACHED BATH) होते हैं, जो के जरासीम की नशवो नुमा और उन के जरीअे इँलने वाले अमराज के जराअेअ हैं. अक बाइयो केमिस्ट्री के माहिर का कहना है : जब से शहरों में वुस्अत, आबादियों की कसरत और भेतों की किल्लत होने लगी है, तब से अमराज की खूब ज़ियादत होने लगी है. क़ाअे हाजत के लिये जब से दूर यल कर जाना तर्क किया है क़बल, गेस, तब्भीर और जिगर की बीमारियां बढ़ गई हैं. यलने से आंतों की ह-र-कतों में तेज़ी आती है. जिस के सबब हाजत तसल्ली बफ़श हो जाती है, आजकल बिगैर यले (घर ही घर में) बैतुल खला में दाखिल हो जाने की वजह से बसा अवकात इरागत भी ताभीर से होती है !

इरमाने मुस्तफ़ा صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस ते मुग़ पर अंड बार दुइटे पाड पढा अल्लाह उंस पर
 एस रहमते बेजता है. (मुस्लिम)

बैतुल जला में जाने की 47 नियतें

इरमाने मुस्तफ़ा صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : “मुसल्मान की नियत उस के
 अमल से बेहतर है.” (अल्मُعْजَمُ الْکَبِیْرُ لِلطَّبْرَانِی ج ٦ ص ١٨٠ حدیث ٥٩٤٢)

✿ सर ढांप कर ✿ जाने में उल्टे पाउं से और ✿ बाहर
 निकलने में सीधे पाउं से पहल कर के ईत्तिबाअे सुन्नत कइंगे ✿ दोनों²
 बार या'नी दाभिले से कबल और निकलने के बा'द मस्नून हुआअें
 पढूंगा ✿ सिर्फ अंधेरे की सूरत में येह नियत कीजिये : तहारत पर
 महद हसिल करने के लिये बत्ती जलाउिंगे ✿ इरागत के झौरन बा'द
 इसराफ़ से बयने की नियत से बत्ती बुजा दूंगा ✿ उदीसे पाक

اَلطُّهُورُ شَطْرُ الْاِيْمَانِ (صَحِيحُ مُسْلِمٍ ص ١٤٠ حدیث ٢٢٣)

तरजमा: “पाकी निरफ़ ईमान है.” पर अमल करते हुआे पाउं को गन्दगी
 से बयाने के लिये यप्पल पहनूंगा ✿ पहनते हुआे सीधे कदम से और
 ✿ उतारते हुआे उल्टे से पहल कर के ईत्तिबाअे सुन्नत कइंगे ✿
 सित्र भुला होने की सूरत में ईस्तिकबाले डिब्ला (या'नी डिब्ले की तरफ़
 मुंह कर ने) और ईस्तिदबारे डिब्ला (या'नी डिब्ले की तरफ़ पीठ कर ने)
 से बयूंगा ✿ जमीन से करीब हो कर इकत हस्बे जइरत सित्र भोलूंगा.
 इसी तरह इरागत के बा'द ✿ उठने से कबल ही सित्र छुपा लूंगा ✿
 जो कुछ पारिज होगा उस की तरफ़ नहीं दे भूंगा ✿ पेशाब के छींटों
 से बयूंगा ✿ हया से सर जुकाअे रहूंगा ✿ जइरतन आंभें बन्द कर
 लूंगा और ✿ बिला जइरत शर्मगाल को देभने और छूने से बयूंगा
 ✿ उल्टे हाथ से ढेला पकड कर उल्टे ही हाथ से भुशक कर के उल्टे हाथ
 की तरफ़ उल्टा (या'नी नजसत वाला हिस्सा जमीन की तरफ़) रहूंगा.

इश्माने मुस्तफ़ा : जो शप्स मुख पर दुइटे पाउ पढना भूल गया वोह जन्नत का रास्ता भूल गया. (त-अशरी)

પાક સીધી તરફ રખુંગા. મુસ્તહબ તા'દાદ મેં મ-સલન તીન³, પાંચ⁵, સાત⁷ ઢેલે ઈસ્તિ'માલ કરુંગા ❀ પાની સે તહારત કરતે વક્ત ભી સિફ ઉલ્ટા હાથ શર્મગાહ કો લગાડિંગા ❀ શર-ઈ મસાઈલ પર ગૌર નહીં કરુંગા (કે બાઈસે મહરૂમી હૈ) ❀ સિત્ર ખુલા હોને કી સૂરત મેં બાતચીત નહીં કરુંગા ઓર ❀ પેશાબ વગૈરા મેં ન થૂકુંગા ન હી ઉસ મેં નાક સિનકુંગા ❀ અગર ફૌરન હમ્મામ હી મેં વુઝૂ કરના ન હુવા તો તહારત વાલી હદીસ પર અમલ કરતે હુએ દોનો² હાથ ધોડિંગા નીઝ ❀ જો કુઇ નિકલા ઉસ કો બહા દૂંગા (પેશાબ કરને કે બા'દ અગર હર ફર્દ એક લોટા પાની બહા દિયા કરે તો بغسل الماء مرة واحدة બદબૂ ઓર જરાસીમ કી અફઝાઈશ મેં કમી હોગી બડા ઈસ્તિન્જા કરને કે બા'દ ભી જહાં એક આઘ લોટા પાની કાફી હો વહાં ફલશ ટેન્ક સે પાની ન બહાયા જાએ ક્યૂંકે વોહ કઈ લોટે પર મુશ્તમિલ હોતા હૈ) ❀ પાની સે ઈસ્તિન્જા કરને કે બા'દ પાઉં કે ટપ્નોં વાલે હિસ્સે એહતિયાત કે સાથ ધો લૂંગા (ક્યૂંકે ઈસ મૌકઅ પર ઉમૂમન ટપ્નોં કી તરફ ગન્દે પાની કે છીટે આ જાતે હૈ) ❀ ફારિગ હો કર જલ્દી નિકલુંગા ❀ બે પર્દગી સે બચને કે લિયે બૈતુલ ખલા કા દરવાઝા બન્દ કરુંગા ❀ મુસલ્માનોં કો ઘિન સે બચાને કે લિયે બા'દે ફરાગત દરવાઝા બન્દ કરુંગા.

અવામી ઈસ્તિન્જા ખાને મેં જાતે હુએ યેહ તિય્યતે ભી કીજિયે

❀ અગર લાઈન લમ્બી હુઈ તો સબ્ર કે સાથ અપની બારી કા ઈન્તિઝાર કરુંગા, કિસી કી હક ત-લફી નહીં કરુંગા, બાર બાર દરવાઝા બજા કર ઉસ કો ઈઝા નહીં દૂંગા ❀ અગર મેરે અન્દર હોતે

इस्माने मुश्कल है : जिसके पास मेरा भिड़ हुआ और उसने मुझ पर दुश्मंते पाऊत पड़ा तहकीक वोह बदनपत हो गया. (ઇબને સુન્ની)

હુએ કિસી ને બાર બાર દરવાઝા બજાયા તો સબ્ર કરુંગા ❁ અગર કિસી કો મુઝ સે ઝિયાદા હાજત હુઈ ઓર કોઈ સપ્ત મજબૂરી યા નમાઝ ફૈત હોને કા અન્દેશા ન હુવા તો ઈસાર કરુંગા ❁ હત્તલ ઈમ્કાન ભીડ કે વક્ત ઈસ્તિન્જા ખાને જા કર ભીડ મેં મઝીદ ઈઝાફા કર કે મુસલ્માનોં પર બોઝ નહીં બનુંગા ❁ દરો દીવાર પર કુઇ નહીં લિખુંગા ❁ વહાં બની હુઈ ફોહ્શ તસ્વીરેં દેખ કર ઓર ❁ હયા સોઝ તહરીરેં પઠ કર અપની આંખોં કો બરોઝે કિયામત અપને ખિલાફ ગવાહ નહીં બનાઉંગા.

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

વેહ રિસાલા પઠ કર દૂસરે કો દે દીખ્યે

શાદી ગમી કી તકરીબાત, ઈજતિમાઆત, એ'રાસ ઓર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કર્દા રસાઈલ ઓર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેશ્લેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિચ્ચતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેશ્લેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે.

માخذ و مراجع

مطبوعه	کتاب	مطبوعه	کتاب
دارالکتب العلمیة بیروت	جامع صغیر	دارالکتب العلمیة بیروت	صحیح بخاری
دارالفکر بیروت	مرقاة الفقاہ	دارابن تزم بیروت	صحیح مسلم
کوئٹہ	احیة للمعات	دارالفکر بیروت	سنن ترمذی
فیاء القرآن پبلی کیشنز مرکز الاولیاء لاہور	مرآة المناہج	داراحیاء التراث العربی بیروت	سنن ابوداؤد
دارالفکر بیروت	فتاویٰ عالمگیری	دارالکتب العلمیة بیروت	سنن نسائی
دارالمعرفت بیروت	ردالمحتار	دارالمعرفت بیروت	سنن ابن ماجہ
رضاقاؤنڈیشن مرکز الاولیاء لاہور	فتاویٰ رضویہ	داراحیاء التراث العربی بیروت	مجمع کبیر
مکتبۃ المدینہ باب المدینہ کراچی	بہار شریعت	دارالفکر بیروت	مجمع الزوائد



اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ اِنَّا بَعْدَ لَاغْوَاةٍ بِاللّٰهِ مِنَ الشُّكِّ الْرُجِيْمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

સુન્નત કી બહારે

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે મહકે મહકે મ-દની માહોલ મેં બ કસરત સુન્નત સીખી ઔર સિખાઈ જતી હૈં, હર જુમા'રાત ઈશા કી નમાઝ કે બા'દ આપ કે શહર મેં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાઝ મેં રિઝાએ ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિયતોં કે સાથ સારી રાત ગુઝારને કી મ-દની ઈજ્તિજા હૈ. આશિકાને રસૂલ કે મ-દની કાફિલોં મેં બ નિયતે સવાબ સુન્નતોં કી તરબિયત કે લિયે સફર ઔર રોઝાના ફિકે મદીના કે ઝરીએ મ-દની ઈન્આમાત કા રિસાલા પુર કર કે હર મ-દની માહ કે ઈજ્તિદાઈ દસ દિન કે અન્દર અન્દર અપને યહાં કે ઝિમ્મેદાર કો જમ્બ કરવાને કા મા'મૂલ બના લીજિયે, اِنَّ اللّٰهَ تَعَالٰى اَعْلَمُ بِالسَّامِعِيْنَ اَعْيُنًا ۝۱۰૦ ઈસ કી બ-ર-કત સે પાબન્દે સુન્નત બનને, ગુનાહોં સે નફરત કરને ઔર ઈમાન કી ઘિકાઝત કે લિયે કુઠને કા ઝેહુન બનેગા.

હર ઈસ્લામી ભાઈ અપના યેહ ઝેહુન બનાએ કે "મુઝે અપની ઔર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. اِنَّ اللّٰهَ تَعَالٰى اَعْلَمُ بِالسَّامِعِيْنَ" અપની ઈસ્લાહ કી કોશિશ કે લિયે "મ-દની ઈન્આમાત" પર અમલ ઔર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે "મ-દની કાફિલોં" મેં સફર કરના હૈ. اِنَّ اللّٰهَ تَعَالٰى اَعْلَمُ بِالسَّامِعِيْنَ

મક-ત-બતુલ મદીના કી શાખેં

સૂરત : વલિયાભાઈ મસ્જિદ, ખ્વાજા દાના દરગાહ કે પાસ. 9898615071

જામનગર : પાંચ હાટડી, 9327977293

મોડાસા : સુકા બજાર, 9725824820

ગાંધીધામ : સપના નગર, મદીના મસ્જિદ કે પાસ, 8141474279

ધોલકા : તાજદારે મદીના મસ્જિદ કે સામને, ટાવર બાઝાર, 9374915797

મક-ત-બતુલ મદીના[®] مکتبة المدینة
દા'વતે ઈસ્લામી

ફેઝાને મદીના, ગી ડોલિયા બગીચે કે સામને, મિરઝાપૂર, અહમદાબાદ, ગુજરાત, ઈન્ડિયા
Mo.091 93271 68200 E-mail : maktabahmedabad@gmail.com www.dawateislami.net